

## એકસઠમા વર્ષમાં પ્રવેશ વેળા

-હો. શશીકાન્ત શાહ

“બરાબર વીસ વર્ષપુર્વમાં મારી આ જ્કોલમમાં એક લેખ વખ્યો હતો. જેનું શીર્ષક હતું : ‘ખું જીવન ચાળીએ પછી થાય છે -લાઈફ બીગીન્સ એટ ફેરી’- અગીયારમી માર્યે હું જીંગીની સફરનાં સાઠ વર્ષપુરાં કરી એકસઠમા વર્ષમાં પ્રવેશ્યો. જીંગીની પાદશાળામાં છ દાયક સુધી અધ્યયન કર્યા પછી હું શું શીખ્યો? જીંગીએ મને શું આપ્યું? મેં સમાજને શું આપ્યું? જીવનના ટનીંગ પોઇન્ટ ઉપર સહેજ થોળીને પસાર થઈ ગયેલો માર્ગ પુનઃ અવલોકતાં પુશ્ટ સંતોષની લાગણી જને છે. પ્રવેલીયનમાં પાછા ફરવાની વેળાએ ખેલાડીને એવો અહેસાસ થાય કે, ‘હું મારી ઈનીંગ ખુબ સારી રીતે રમ્યો,’ તો એનાથી વિશેષ બીજું શું જોઈએ?”

હાર્ટ્ડ યુનીવર્સિટીના મનોચીકીટ્સક જ્યોર્જ વેઈલન્ટે પાંત્રીસ વર્ષ સંશોધન કરીને એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની કોશીશ કરી કે પ્રસન્તાપુર્વક વૃદ્ધત્વ તરફ ગતી કરવાનો માર્ગ કયો છે? માત્ર લાંબું-દીર્ઘ જીવન નહીં; સુખી જીવન જીવવામાં આપણને કયાં પરીબળો મદદરૂપ બને છે? ૧૯૭૭માં હાર્ટ્ડ યુનીવર્સિટીના બે સંશોધકે બસો અહસઠ પુરુષ સ્નાતકોને કેન્દ્રમાં રાખીને એક અભ્યાસ હાથ ધર્યો, જે અંતગત પ્રસન્તાપુર્વક, આનંદની અવસ્થા જળવી રાખીને વૃદ્ધત્વ તરફ આગળ વધવામાં કયાં પરીબળો મદદરૂપ બને છે તે જીવનનો ઈરાદો હતો. પાંત્રીસ વરસ સુધી ચાલેલું આ સંશોધન, માણસને સુખી, સંતોષી વૃદ્ધત્વ તરફ દોરી જતાં અને માંદલાં, અસંતુષ્ટ હતાશ-નીરાશ વૃદ્ધત્વથી બચાવતાં પરીબળો પર ધ્યાનાકર્ષક પ્રકાશ ફેંકે છે.

જ્યોર્જ વેઈલન્ટ નોંધે છે : આપણને પ્રસન્ત વૃદ્ધત્વ તરફ દોરી જતા ચાર મુદ્દા તરફ અમારું ધ્યાન ગયું છે. જીંગીની સફરમાં આપણને જે ખરાબ માણસો ભટકાય છે એમનો પ્રભાવ આપણા જીવન પર, આપણી પ્રસન્તા પર ન પડે તેની કાળજી લેવી. સારા અને પ્રોત્સાહક મીત્રોની વચ્ચે જીંગીનો આનંદ માણતા રહેવું તે પહેલું પરીબળ છે, જે માણસને પ્રસન્તાપુર્વક વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. જેમણે આપણને દુઃખ આપ્યું, હેરાન કર્યા, તકલીફી આપી એમને ક્ષમા આપીને માફ કરી દઈ, સારા અને સાચા મીત્રોની વચ્ચે જીવનનો આનંદ માણતા રહેવું તે આનંદમય વૃદ્ધત્વ તરફ દોરી જનારું બીજું પરીબળ છે. “ફરીયાદ છોડો, અન્યાય થયાની લાગણીથી બચો, ‘બધાએ મળીને મને ખુબ ત્રાસ આયો’ એવી મનોગ્રંથીમાંથી બહાર નીકળો અને સંતોષપ્રદ અનુભવોને ધ્યાનમાં લઈ એકસઠમા વર્ષમાં દબદ્ધબાબેર, ભવ્યતાથી પ્રવેશ કરો. પ્રવેશદ્વાર પર નવી ખુશીઓ અને નવા મીત્રો તમને આવકારવા આતુર થઈને ઉભા છે,” એવું જ્યોર્જ વેઈલન્ટનું અવલોકન ધ્યાને લેવા જેવું ગણાય.

આનંદપ્રદ વૃદ્ધત્વ તરફ દોરી જનારું ત્રીજું તત્ત્વ છે, ‘યુવાન મીત્રો, યુવાન સંતાનો, શૈશવ માણી રહેલાં પૌત્ર-પૌત્રીઓ અને પરીવારનાં પ્રેમાળ સ્વજનો.’ જ્યોર્જની સલાહ છે કે, ‘જે મીત્રો છુટી ગયા છે એમને માટે, એમની પાછળ રહવાનું માંડી વાળી, જેમણે નવા મીત્રો શોધ્યા, સમવયસ્ક સાથીદારોના સાંન્નીધ્યમાં જીવનનો સાત્તવીક આનંદ શોધવાની કોશીશ કરી, તેઓ ફાયા અને પ્રસન્ત ચહેરે એકસઠમા વર્ષમાં પ્રવેશવા ધનભાગી બન્યા. કહવા અનુભવોને ભુલાવી દો, બેવજ્ઞાઈ આચરનારા, દોહ કરનારા, વીધાસધાતી મીત્રો, સાથીદારો, સંબંધીઓનું નામ હોઠો પર લાવવાની ભુલ કરશો નહીં. એમને પાછળ છોડી દઈને, ભુલી જઈને, જીંગીની સફરમાં પ્રસન્તા જળવી રાખીને આગળ વધો.’

નીઃસ્વાર્થ, નક્કર, સર્જનાત્મક સામાજિક પ્રવૃત્તીઓમાં જેઓ પોતાની જતને જોડી શક્યા, સાઠ વર્ષ સુધી સમાજ પાસેથી જેમણે ઘણું મેળવ્યું, એમાંનું થોડુંક ઋણ ચુકવવા જેમણે કોમ્પ્યુનિટી-સર્વીસને પોતાના શેષ જીવનનું કેન્દ્રભીંદું બનાવ્યું તેઓ રુઆબાબેર, આત્મગૌરવ સાથે સાઠ વર્ષપુરાં કરી એકસઠમા વર્ષમા પ્રવેશી શક્યા. આ તબક્કે સત્તા નહીં, રાજકારણ નહીં, આનંદ-કારણ જીવનનું મુખ્ય લક્ષ્ય બને. માણસ વીસમા વર્ષે પણ વૃદ્ધ હોઈ શકે છે. જે વીષાદગ્રસ્ત છે તે વૃદ્ધ છે. જે હીમત હારી

ચુક્કો છે, જેણે જુંદગીના ખેલમાં રમ્યા વગર જ હાર સ્વીકારી લીધી છે તે વીસમા કે ત્રીસમા વર્ષે પણ વૃદ્ધત્વનો અનુભવ કરી શકે છે. જે સુંદરી ધરાવે છે, આનંદમાં રહે છે, થાક્યા વગર ચાલી શકે છે, દોડી શકે છે, મીત્રોની મહેશીલમાં સામેલ થઈને ગીત ગાઈ શકે છે, નાચી શકે છે, હસી શકે છે તે નેતુંમા વર્ષે પણ યુવાન છે-યુવાન રહેવા સર્જિયેલો છે.

સાઠ વર્ષ પુણ્ણ કર્યા પછી આપણી પાસે કંઈ હોતું નથી એવું કોણે કહ્યું? આ તબક્કે આપણી પાસે વીકલ્પો હોય છે, પસંદગીની ભરપુર તકો હોય છે. હકીકતોનો સ્વીકાર કરો, વાસ્તવીકતાને સ્વીકારો. એવી પરીસ્થીતી કે જેને તમે બદલી શકતા નથી, એવા માણસો જેમને તમે કદીયે બદલી શકવાના નથી એ હકીકતોને તમે સ્વીકારી લો. પરીસ્થીતી પર આપણો કાબુ હોતો નથી, કબુલ; પરંતુ પ્રતીકુળ સંજોગને કેવો પ્રતીભાવ આપવો તેની પસંદગી આપણી પાસે હમેશાં હોય છે. જ્યારે આપણો ચીંતા કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા ખર્ચાં છે-વપરાય છે અને આપણે નીર્બંધ બનીએ છીએ. ચહેરા પરનું સ્મીત ખોવાઈ જાય છે. જ્યારે આપણે વાસ્તવીકતા સ્વીકારીને, સંજોગો સાથે જઘફવાનું બંધ કરીએ ત્યારે ઉર્જાનો સંચય થાય છે. ઉર્જાનું સર્જન પણ થાય છે. તમે જ્યારે એવું વીચારો છો કે, ‘હું મારા જીવનના ચાર્જમાં છું. મારા જીવન પર, મારા નીણથી પર મારો કાબુ છે. હું મારી ભુલો, મારી મર્યાદાઓ અને મારી તાકાત, શક્તીને ઓળખવા જેટલો, સ્વીકારવા જેટલો અને જરૂર પડે તો સુધારવા જેટલો પુખ્ત અને સમજદાર પણ છું. હવે પછી સધર્ષ નહીં; સંવાદ મારું લક્ષ્ય હશે, મારું ધેય હશે અને તેને અનુરૂપ હું મારા જીવનને ગોઠવીશ,’ ત્યારે તમે સ્વર્ણ અને પ્રસન્ન ચીતે એકસઠમા વર્ષમાં પ્રવેશવાના હક્કદાર બનો છો.

એકસઠમાં વર્ષમાં પ્રવેશ કરતી વેળા હું કેવી લાગણી અનુભવું છું? પુણ્ણ સંતોષની લાગણી અનુભવવા સાથે મારે ઉમેરવું જોઈએ કે જુંદગીની પાઠશાળામાંથી ખુબ મહત્વના કહી શકાય એવા ઘણા પાઠો હું શીખ્યોછું, શીખી રહ્યો છું. ‘જે સાથે છે તે સાથે નથી; સામે છે,’ એવા અનુભવો મને એટલી બધી વાર થયા છે કે હવે એવો એકાદ વધુ અનુભવ ઉમેરાય તો આઘાત લાગતો નથી, રમુજ જન્મે છે! ‘મારે કંઈ જ મેળવવું નથી, કંઈ જ જોઈતું નથી,’ એવા નીર્ધાર સાથે જીવન જીવવાની ‘બાદશાહી’ હું માણી શક્યો. તમે જ્યારે અપેક્ષા રાખો છો, યાચના કરો છો, કંઈક મેળવવા માટે જીવો છો, સમાધાન કરો છો; ત્યારે તમે તમારી જુંદગીના માલીક રહેતા નથી. તમે બીજાને ખુશ રાખવા માટે, રાજી રાખવા માટે, બીજાની મહેરબાની મેળવવા માટે જીવો છો. ત્યારે તમારું આત્મગૌરવ પણ હણાય છે, ચહેરો નીસ્તેજ બની જાય છે અને તમે મનની પ્રસન્તા ગુમાવીને વીષાદગસ્ત બનો છો. કંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર તથા જે કંઈ થોડુંથણું મળ્યું હોય તે ગુમાવવાની તૈયારી રાખીને પોતાની રીતે, સમાધાનો કર્યા વગર જીવન જીવવાની એક મજા છે, એક આનંદ છે અને તે આનંદ સાઠ વર્ષ સુધી પ્રત્યેક ક્ષાળો મેં માણ્યો છે.

એસઠમાં વર્ષમાં પ્રવેશતી વેળા વીચાર કરું છું: જીવનમાં મારી શ્રેષ્ઠ ઉપલબ્ધી કઈ? પ્રસન્ન પરીવાર, જેના હાથમાં હાથ રાખીને આનંદમય સ્થીતીમાં વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યો છું એવી મારી જીવનસંગીની કુમુદ, જેઓ કદી સાથ ન છોડે એવા થોડાક કાયમી (પરમેન-નાન્ફાર્ન્ડ!) સ્વજનો અને મીત્રો. બસ, જેની પાસે આટલી મીરાત હોય તેને આખી દુનીયાની અમીરાતનો શો ખ્ય?

### સર્જનનું:

મીત્રોનો સ્વાંગ રચીને ગરજવાન માણસો મને જુંદગીમાં વારંવાર ભટકાયા. એમનો મુકામ પોતાનું કામ નીકળી જાય એટલા પુરતો; પછી તમે કોણ ને હું કોણ? માણસોની ખુબ ઉચ્ચી પરખ હોવાથી આવા હેતુ-સાધક ‘મીત્રો’ને મેં દીલમાં દોસ્તીનો દરજા આપવાની ભુલ કરી નથી. જેમને મીત્ર ગણ્યા ન હોય એમનું આવાગમન ખુશી કે વીષાદનું કારણ બની શકે નહીં. મેં મારા

જીવનમાં પ્રવેશેલા મીત્રોને કદી ગુમાવ્યા નથી. મીત્રની ઓળખ જ એ છે કે જીવનમાં પ્રવેશ્યા પછી કદી બહાર નીકળતો નથી.

સુરતના 'ગુજરાતમીત' દૈનિકના તા. ૧૨ માર્ચ ૨૦૦૮ના અંકમાં પ્રકાશિત લેખકની કટાર 'માણસ નામે ક્ષીતીજ' માંથી સાભાર..૩૦મી માર્ચ, ૨૦૦૮ના દીને પ્રકાશિત થનારા, લેખકના 'ક્ષીતીજ' નામના પુસ્તકમાં પણ આ લેખ સમાવાયો છે..

--ડૉ. શશીકાંત શાહ 'એકલબ્ય'

સંપર્ક : ૩૫-આવીજાર રો હાઉસ, તાડવાડી, સુરત-૩૯૫ ૦૦૫ ફોન : (૦૨૬૧) ૨૭૭ ૬૦૧૧

મોબાઇલ : ૯૮૨૫૨ ૩૩૧૧૦ ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in

'સન્ને ઈ-મહેસૂલ' -- વર્ષ : ત્રીજું -- અંક : ૧૪૭ -- March 30, 2008  
 'ઉત્તાજોહણી'માં અને 'વીજયા' ફેન્ટમાં અક્ષરાંકન : uttamgajjar@hotmail.com

♦♦♦♦♦



### પરીચય

સુરત જીવલાના બહુધાન ગામે ૧૯૪૮માં જન્મેલા ડૉ. શશીકાંત શાહ આમ તો એમના ગુરુ ડૉ. ગુણવંતભાઈ શાહની જેમ વીજાન(કેમીસ્ટ્રી)ના વીધાથી. બી.એસ.સી. અને એમ.એડ. સુધી એમની અભ્યાસ-કારકીર્દી ફર્સ્ટ કલાસ ડીસ્ટીંક્શનની રહી. ડૉ. ગુણવંત શાહના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી અધ્યાપક બન્યા. આજે તેઓ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સિટીમાં પોફેસર અને શીક્ષણ વીમાગના વડા તરીકે સેવા આપે છે. કેનેડા, અમેરિકા, યુ.કે., ઓમાન, સીંગાપોર, મલેશીયા વગેરે દેશોમાં ફરી શીક્ષણ અંગે વ્યાખ્યાનો આપ્યાં છે અને ઘણાં સંશોધન પ્રોજેક્ટ્સ પણ કર્યો છે.

શીક્ષણનો બહોળો અનુભવ અને ચીંતનને વરેલા ડૉ. શશીકાંતભાઈ વધારે પરીચીત છે; સુરતના લોકપ્રીય દૈનિક 'ગુજરાતમીત'માં છેલ્લાં વીસ વરસથી પ્રગટતી એમની સાપ્તાહીક કોલમ 'માણસ નામે ક્ષીતીજ'ના પ્રકાશનથી. માનવની સારપભરેલી મુણસુત પ્રકૃતી પર એમને ભારોભાર ભરોસો. તેથી યુવાનો માટે વ્યક્તી-વીકાસના અનેક કાર્યક્રમો અને તાલીમ શીખીરો તેઓ આપતા રહે છે. એમની ખરી નીજરતા અને શીક્ષણ-જગતના એક પ્રહરીની એમની મુદ્રા પ્રગટતી રહે છે એમની બિલ્લ સાપ્તાહીક કટાર 'શીક્ષણ અને સંસ્કરની સમસ્યાઓ'માં. શશીકાંતભાઈ સુરતનું શીક્ષણ-જગતનું મુલ્યવાન રત્ન છે.

-ઉત્તમ ગજજર (સુરત) અને બળવંત પટેલ (ગાંધીનગર)

\*\*\*

‘જીવનને ધરાઈને માણ્યા વીના ઘરજા થઈ ગયેલા ખરચરો જ ઘણુંખરું નવી પેઢીની નીંદા કરતા હોય છે. માંહ્યલાને જે સાચું ન જણાય તેને સતત વેઠનારો મનુષ્ય જલદી ઘરજો થઈ જાય છે. યુવાનીમાં જેઓ જીવનનો આનંદ નથી પામ્યા એવા વંચીત વૃદ્ધો પરીવારમાં અનેક જોખમો ઉભાં કરે છે. તેઓ ક્યારેક સંતાનોનાં સુખમાં દીવાસળી ચાંપે છે.

આપણા સમાજમાં સદીઓથી એક ઘરરું અનીછ પોખાતું રહ્યું છે. જેની સાથે બીલકુલ ફરજ નહીં હોય તેવી વ્યક્તિને પણ કાયર મનુષ્ય જી છોડી શકતો નથી. કેટલાંય સુધી સંતાનો માતાપીતા તરફથી સતત થતી પ્રેમાળ હેરાનગતી વેઠતાં રહે છે. એ જ રીતે કેટલાંક મજબૂર માતાપીતા અળવીતરાં સંતાનો સાથે કેવળ પરંપરાને કારણે પડી રહેતાં હોય છે. એકબીજાને પ્રતીક્ષણ ધીકરાનારાં પતી-પત્ની ક્યારેક એક જ ફ્લેટમાં આખું આયખું ખેંચો કાઢે છે. માનશો? તેમની સાથમી લગ્નતીથી ધૂમધામથી ઉજવાય છે!!

-ગુજરાતની શાહ

તા. ૨૦ જાન્યુઆરી ૨૦૦૮ની ‘દીવ્યભાસ્કર’ દૈનિકની રવીવારીય પુરીમાંથી સાભાર..  
લેખક ‘દીવ્ય ભાસ્કર’ દૈનિકની રવીવારીય પુરી ‘રસરંગ’ના કટાર લેખક છે.

‘સંને ઈ-મહેશ્શીલ’ -- વર્ષ: ત્રીજું -- અંક: 147 -- March 30, 2008  
‘ઉત્તમાજોહણી’માં અને ‘વીજ્યા’ શેન્ટમાં અક્ષરાંકન: [uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)

●  
૧૩મી જાન્યુઆરી ૨૦૦૬ના દીને મુંબઈ ખાતે ગુજરાતી લેક્સિકોનના થયેલા પ્રથમ લોકપર્ણને રૂ  
રૂસ પુરાં થયાં. આ બે વરસમાં 7,85,000 જેટલા ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં  
<http://www.gujaratilexicon.com> ની મુલાકાત લીધી. આપને અને આપ મારફત આપના મીત્રોને  
પણ લેક્સિકોનની આ નવી interfaceની મુલાકાત લેવાનું નીમંત્રણ છે. વીધનાં કરોડો ગુજરાતી  
ભાઈ-બહેનો સુધી આ સંદેશો પહોંચાડવામાં સહાય કરી, આપને પણ ગુજરાતી ભાષાની અમૃત્ય  
સેવાના પુણ્યના અધીકારી બનવા વીનંતી.

વપરાશકરોના મળેલાં મુલ્યવાન સુચનો અનુસાર અમે <http://www.gujaratilexicon.com> રૂ  
ઉદ્ઘતે પાને જ અમારું ‘સરસ ગુજરાતી સ્પેલયોકર’ આકૃતી સાથે ડાઉનલોડ લીક જોડી મુક્યું છે.  
આપ તે ડાઉનલોડ કરો અને તેની ક્ષમતા ચકાસી સુચનો મોકલી એવી વીનંતી કરીએ હીએ.  
આપ સૌના સહયોગ થકી ‘સંને ઈ-મહેશ્શીલ’ના 8,300 જેટલા વાચકો થયા અને રોજેરોજ નવાં નામો  
ઉમેરાતાં જાય છે એ પુરવાર કરે છે કે, દેશવીદેશમાં ગુજરાતી વાચનના રસીયા બહુ મોટી સંખ્યામાં છે.  
સૌનો આભાર... અમારી ‘સંને ઈ-મહેશ્શીલ’ની અત્યાર સુધીની જુની સઘળી પીડીએફ ફાઈલો અમારી  
વેબસાઈટ <http://gujaratilexicon.com/index.php?aciton=downloadSeM>

પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકશે. આ જ વેબ સાઈટ પરથી લેક્સિકોન અને શ્રી. વીપુલ  
કલ્યાણી તરફથી લંઘનથી પ્રકાશીત થતા ‘ઓપીનીયન’ માસીકના તદ્દન તાજા અંકોની અને શ્રી. પ્રવીણ  
વાધારણ (મેલ્બોર્ન-ઓસ્ટ્રેલીયા) તરફથી પ્રકાશીત થતા ‘માતૃભાષા’ માસીકની મુલાકાતે પણ જઈ  
શકાશે..

◆

● મધુરેણ સમાપયેતુ ●



"બહેન... , પહેલાં કાપડ તો પસંદ કરો...!"

'સીક્કો' તો તમે જે મીલનો કહેશો તે મારી આપીશું... ,

અમે બધી જ મીલોના સીક્કા તૈયાર રાખીએ છીએ..

એકદમ ઓરીજનલ...!

રેમન્ડ, ચ્વાલીયર, બોગ્ઝે ડાઇંગ, અરવીંદ, વીમલ,

ખટકુ, હીમસન, ગાર્ડન..."

*mahendra*

પેન્સીલ્વેનીયા-અમેરિકામાં વસેલા અમદાવાદી કાર્ટૂનિસ્ટ શ્રી. મહેન્દ્રભાઈ શાહનો

ઈ-મેઈલ સંપર્ક: [mahendraaruna@msn.com](mailto:mahendraaruna@msn.com)

એમનો પરીચય પામવા અને એમનાં ખુબ બધાં કાર્ટૂન્સ માણવા જુઓ એમની

web site : [www.ameamericanamdaavadi.com](http://www.ameamericanamdaavadi.com)

♦♦♦

'સન્-એ-ઈ-મહેન્દીલ' -- વર્ષ: ત્રીજું -- અંક: 147 -- March 30, 2008

'ઉત્તાજોહણી'માં અને 'વીજયા' ફેન્ટમાં અક્ષરાંકન: [uttamgajjar@hotmail.com](mailto:uttamgajjar@hotmail.com)

♦♦♦♦♦♦